

# કૃતજ્ઞતાનો અભાવ

## બાબા મુક્તાનંદ દ્વારા કથિત એક વાર્તા

મારી સાધના દરમ્યાન જ્યારે હું ભારતભરમાં ભ્રમણ કરતો હતો ત્યારે ઘરુણીવાર મેં ત્યાંના ગામડાંઓમાં એક વાર્તા સાંભળી હતી. આ વાર્તા એક ઉદાર વ્યક્તિ અને એક લિખારી વિશે છે અને ગામનાં લોકો તેને મરાઠી ભાષામાં કવિતાઙ્કૃપે કહેતાં હતાં.

એક સમૃદ્ધ અને ઉદાર સ્થીના ઘરે એક લિખારી ભીખ માગવા આવતો હતો. એ ભીખમાં દૂધ માગતો અને તે સ્થી ખુશીથી તેને એ આપતી. આવું બાર વર્ષોં સુધી દરરોજ ચાલતું રહ્યું.

એક દિવસ સવારે, જ્યારે લિખારી ભીખ માગવા આવ્યો તો તે સ્થીએ કહ્યું કે આજે તેની ગાયે હજુ દૂધ આપ્યું નથી. પરંતુ, તેની પાસે એક ડોલ ભરીને છાશ છે જે એને ખુશીથી આપી શકશે.

લિખારી તરત જ અત્યંત ગુસ્સે થઈ ગયો અને તે સ્થીને બૂમો પાડીને બોર-બોરથી બોલવા લાગ્યો. “તું કેટલી કંજૂસ છે! તારી પાસે કેટલી બધી ધન-સંપત્તિ છે. તારી પાસે અનાજના ભંડાર છે. તારા ઘરમાં તો દૂધની નહીંઓ વહે છે. તોપણ તું મને દૂધ આપવાની ના પઢે છે અને કહે છે કે તેના બહલે તું મને માત્ર છાશ આપશો. હકીકતમાં તો, તું મને કહી રહી છે કે હવેથી તું મને દૂધ નહીં આપે!”

એ દાતાર સ્થીને લિખારીની આ પ્રતિક્રિયાથી આશ્વર્ય થયું.

તોણે લિખારીને બાર વર્ષોં સુધી દરરોજ દૂધ આપ્યું હતું, તેમ છતાં માત્ર એકવાર ના પાડવાથી એ ગુસ્સાથી તપી ઉઠ્યો અને નિર્દ્યતાથી તેની નિંદા કરવા લાગ્યો.

થોડીવાર પછી, એ લિખારી છાશ લીધા વગર જતો રહ્યો.

